



Date: 01/06/2024

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai- 400001

Scrip ID/ Code / ISIN : ZEAL/539963 / INE819S01025
Subject : Intimation of Newspaper Advertisement of Extract of Standalone Audited Financial Results for the quarter and year ended 31-03-2024
Reference No. : Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

Dear Sir/Madam,

We wish to inform that pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of Extract of Standalone Audited Financial Result for the quarter and year ended on 31st March, 2024 published in Newspapers on 01st June, 2024.

1. English Daily: "Free Press Gujarat" dated 01st June, 2024.
2. Regional Language Daily: "Lokmitra" dated 01st June, 2024.

You are requested to kindly take the same on record.

Thanking you
Yours Faithfully,

Kindly take the same on your records.

Yours Faithfully,
For Zeal Aqua Limited

PRADIPKUMAR RATILAL NAVIK
WHOLETEIME DIRECTOR
DIN: 01067716

Place: Surat

Encl: Copy of Newspapers

IIFL Samasta to Raise up to Rs. 1,000 Crores via Bonds



2024. IIFL Samasta Finance will issue bonds, aggregating to Rs 200 crore, with a green-shade option to retain over-subscription of up to Rs 800 crore (aggregating to a total of Rs 1,000 crore). The IIFL Samasta bonds offer highest coupon rate of 10.50% per annum for tenor of 60 months. The NCD is available in tenors of 24 months, 36 months and 60 months. The frequency of interest payment is available on monthly and annual basis for each of the series. The credit rating is 'CRISIL AA+/Watch Negative' by CRISIL Ratings Limited and 'Acute AA' Rating Watch Negative Implication' by Acute Ratings and Research Limited. IIFL Samasta Finance's MD and CEO Mr. Venkatesh N said, "IIFL Samasta Finance has a strong physical presence across India through about 1,500 branches. It caters to the credit needs of underserved and unbanked population, primarily women entrepreneurs from underprivileged background through a well-diversified portfolio. (1-7)

Ahmedabad, IIFL Samasta Finance, which is one of India's largest non-banking microfinance companies (NBFC-MFI), will raise up to Rs 1,000 crores through public issue of secured bonds, for the purpose of capital augmentation and business growth. The bonds offer up to 10.50% and high degree of safety. The issue opens on Monday, June 3, 2024 and closes on Friday, June 14,

US campus protests: What Indian students, parents and professors need to know to get serious about future

The fires raging through American universities at the moment, and what they mean for the Indian student and student populations there, need to be taken very seriously if we are to avoid a different kind of "Partition" between families, friends, and even religions, cultures and civilisations. That Partition is already underway. On one side are people who believe that bloodshed is morally wrong only if it happens to a university-certified, celebrity-endorsed "oppressed" group and violence done to other human beings, whether actual combatants or civilians, is permissible because they can be certified as "colonisers". On the other side are people with a range of confused opinions, baffled by the rapid normalisation of violence, dehumanisation, divisiveness, and moral relativism. The latest violence may be a simple majority in the world, in America, and even in American universities, still, but is being enormously outplayed at every corner by the first.

correct the cause is. And among students less vulnerable to deportation because of "ideology" or fears, such as South Asian-descent American citizens, the inclination to join protests seems larger. There is a tendency to view this situation in simple Left-Right terms, with "Palestine" on the Left and "Zionism" on the Right. But that is not the whole picture, and ends up falling into the trap set by Far-Right Religious Imperialist.

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

E-AUCTION FOR NON FARE REVENUE CONTRACTS

With reference to above, Bids are invited on E-auction for Non Fare Revenue contracts of Ahmedabad Division for following categories, which have been already published on IREPS website. The details are furnished as under -

| Catalogue No. | Type of Contract | Category | Date & Time of E-Auction |
|---------------|---------------------------|--|--------------------------|
| WFRADI-624 | Advertising - Out of Home | E-Auction for all the lots will start at 12:00 Hrs. on date 13-06-2024 | |

Note: (1) Prospective Bidders are requested to visit the E-Auction Listing module on the website www.ireps.gov.in and get themselves registered before participating in the auction. (2) The Lot-wise details under above mentioned Catalogue No. are available under the head of the upcoming e-auction. Zone: Western Railway, Unit: Ahmedabad Division-Commercial. (3) Initial Cooling Off period is 30 minutes. Successive Lot Closing interval is 10 minutes. Lot-wise Closing Time can be viewed in the E-Auction module of IREPS. (4) For any queries related to scheduled auction, please reach us at etrc@wdr.railtel.gov.in or on +91-9726929366. www.ireps.gov.in

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

ELECTRICAL WORK

E-Tender Notice No. S-02EETRA/DI02 (2024-25) dt. 27-05-2024. Sr. No. 1: Tender No. TRD-ADI-1-02-2024-25 Name of Work: Ahmedabad-Palampur section: Replacement of composite type stay tube, bracket tube and 9-tonne insulator with porcelain insulator. Estimated cost: ₹ 1,01,47,846/-. Earnest Money: ₹ 2,00,700/- Date and Time of Submission and opening: Not later than 15:00 Hrs. dt. 26-06-2024 and 24-06-2024 at 15:30 Hrs. Address of the office and Website details: Sr. Divisional Electrical Engineer, D.R.M. Office (W.R.), Near Charnauda bridge, Opp. G.C.S. hospital, Naroda road, Amdapura, Ahmedabad-382425. Website details: www.ireps.gov.in ADI02

WESTERN RAILWAY - RAJKOT DIVISION

ALLIED WORK FOR LIFTS

Tender Notice No. DRMR/JT/E-Tender/2024-2025/03 (EL) Dt. 27-05-2024. Tender No. DRMR/JT/E/2024-2025/03 (I) Name of Work: Rajkot Division: Allied work for Lifts in connection with providing 12 in wide FOB works in connection with Amrit Bharti Station Scheme at Bhalkinger, Morbi, Surendranagar, Wankaner, Dwarika, Than Station. (ii) Approx. Cost: ₹ 91,98,888/-. (iii) EMD Cost: ₹ 1,84,000/- (iv) Date and time for on line apply: on 27-06-2024 up to 15:00 Hours. (v) Address of the Office: Divisional Railway Manager (Electrical), Western Railway, Kothi Compound, Rajkot-360 001. Web site particulars: www.ireps.gov.in RJT06

SIKKO INDUSTRIES LIMITED

CIN: L51909GJ2000PLC037329
 Regd. Off: 508 Iscon Elegance, Nr. Jain Temple, Nr. Prahladnagar Pick up Stand, Vejalpur, Ahmedabad - 380051,
 Telephone : +91 79- 66168950/66168951
 Website : www.sikkoindia.com, E-mail : compliance@sikkoindia.com

EXTRACT OF STANDALONE FINANCIAL RESULT FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2024

| Particulars | ₹ (in Lakh except EPS) | | |
|--|-----------------------------|--------------------------|-----------------------------|
| | Quarter ended on 31/03/2024 | Year ended on 31/03/2024 | Quarter ended on 31/03/2023 |
| Total Income From Operations | 1,762.59 | 6,470.59 | 1,115.55 |
| Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items) | 141.42 | 605.81 | (22.80) |
| Net Profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) | 141.42 | 605.81 | (22.80) |
| Net Profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items) | 65.27 | 406.44 | (40.73) |
| Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)) | 65.27 | 406.44 | (40.73) |
| Equity Share Capital | 1,680.00 | 1,680.00 | 1,680.00 |
| Reserves (excluding Revaluation Reserve as per the audited Balance Sheet of the previous year) | 1,107.45 | 1,107.45 | 701.01 |
| Earnings Per Share (for continuing and discontinued operations) - | | | |
| Basic: (not annualized for the quarter ended) | 0.39 | 2.42 | (0.24) |
| Diluted: (not annualized for the quarter ended) | 0.39 | 2.42 | (0.24) |

Note:-
 1. The above financial is an extract of the detailed format of Audited Financial Results for the quarter and year ended on March 31, 2024 filed with the NSE Limited under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulation, 2015. The full format of the Audit Financial Results for the quarter and year ended on March 31, 2024 are available on the Website of stock exchange at www.nseindia.com and Company's website at www.sikkoindia.com.

For, Sikko Industries Limited
 Sd/-
 Jayantibhai Mohanbhai Kumbhani
 Managing Director
 DIN: 00587807

Date : May 30, 2024
 Place : Ahmedabad

Ultimate Table Tennis 2024



Ahmedabad, Ultimate Table Tennis (UTT), India's premier table tennis league, distinguished by its ability to attract top-tier international talents and facilitate the rapid advancement of Indian paddlers, is gearing up for an exciting new season in Chennai from August 22 to September 7 at the Jawaharlal Nehru Indoor Stadium. The franchise-based league, promoted by Niraj Bajaj and Vita Dani under the auspices of the Table Tennis Federation of India (TTFI) has been strategically coinciding with the post-Paris Games period to capitalize on the prevailing Olympic fervour nationwide. Moreover, the decision to host the league in Chennai pays tribute to the city's esteemed sporting heritage, which has produced numerous legendary paddlers, but also reinforces our commitment to honouring its illustrious legacy," expressed Niraj Bajaj, co-promoter of UTT. (20-4)

NSDC and ILO forge a strategic partnership



Ahmedabad, Furthering the Skill Mission, the National Skill Development Corporation (NSDC) under the aegis of the Ministry of Skill Development & Entrepreneurship (MSDE) and the International Labour Organization (ILO) today announced a strategic partnership to advance skill development and lifelong learning in India and globally. This collaboration aims to empower individuals across the globe, by equipping them with essential competencies and qualifications, thereby enhancing employability and sustainable economic growth. The MoU was signed by Mr. Ved Mani Tiwari, CEO, NSDC and Mr. Sangheon Lee, Director, Employment Policy, Job Creation and Livelihoods Department, ILO, reaffirming both organizations' commitment to leveraging their strengths and expertise in talent development. This partnership is dedicated to developing effective policies, governance and financing structures which will enhance skill development both nationally and internationally. A key aspect of the partnership is the implementation of the Skill India Digital Hub (SIDH). This digital transformation will streamline skill development initiatives, enhancing their efficiency, accessibility, and global impact. (20-4)

WESTERN RAILWAY - AHMEDABAD DIVISION

FOURTHLY TENDER ADVERTISEMENT

Tender Notice No. AD/SP/Tender publication/2024/06 Dated : 27-06-2024 Sr. DMW Ahmedabad on behalf of the President of India invites following electronic open tenders for supply of materials:

| Sr. No. | Brief description of material | Qty. | Tender Closing Date |
|---------|--|-----------|---------------------|
| 1. | 15 KVA Transformer | 26 Nos | 24-06-2024 |
| 2. | Set of EVAPORATOR coil assembly | 38 Sets | 24-06-2024 |
| 3. | Raised register arm clamp | 10000 Nos | 25-06-2024 |
| 4. | SITC of Microprocessor-based control and fault diagnostic system | 2 sets | 26-06-2024 |

Regarding detailed tender notice containing purchase restrictions and detailed tender conditions, please visit website www.ireps.gov.in. Manual offers will not be considered.

Like us on: [Facebook.com/WesternRly](https://www.facebook.com/WesternRly) Follow us on: [Twitter.com/WesternRly](https://twitter.com/WesternRly)

GOVERNMENT OF INDIA, DEPARTMENT OF SPACE, SPACE APPLICATIONS CENTRE (SAC), CONSTRUCTION & MAINTENANCE GROUP (CMG), ELECTRICAL & FIRE ALARM SYSTEM DIVISION, JODHPUR TEKRA, AMBAWADI VISTAR PL., AHMEDABAD - 380015. Ph. No: (079) 26914917/08/07/01, Fax No: (079) 26915800.

Corrigendum No: 1, dated 29.05.2024

Name of work: SITC of 40 H.P. soft starter in place of ATS type starter panel and miscellaneous electrical works for Antiradiation colony, Ahmedabad- Electrical works.

E-Tender Notice No. SAC/CMG/ENR/02/2024-25 Dt: 08.05.2024
 Estimated Cost - Rs. 5.38 Lakh, Period of Completion - 03 Months

The sale period bid clarification date, last date for receipt of tenders & due date for opening of tenders are modified as follows :

| Sl. No. | Description | Dates as per NIT | Date Revised as per this Corrigendum No. 1 |
|---------|--|--|--|
| 1 | Period during which the tender document will be available for inspection | From 14.05.2024 at 10.00 Hrs to 22.05.2024 up to 17.00 Hrs | From 14.05.2024 at 10.00 Hrs to 11.05.2024 up to 17.00 Hrs |
| 2 | Last date and time for uploading of tenders | 22.05.2024 upto 17.00 Hrs | 13.06.2024 upto 17.00 Hrs |
| 3 | Due date and time of opening of tenders | 29.05.2024 upto 11.00 Hrs | 14.06.2024 upto 11.00 Hrs |

All other conditions stipulated in the above NIT will remain unaltered.

Group Director CMG/SAC

Maruti Infrastructure Limited

Extract of Consolidated Audited Financial Results for the Quarter and Year ended on 31st March, 2024

| Sr. No. | Particulars | Consolidated | | | |
|---------|--|--------------------------|--------------------------|-----------------------|-----------------------|
| | | Quarter ended 31-03-2024 | Quarter ended 31-03-2023 | Year ended 31-03-2024 | Year ended 31-03-2023 |
| 1 | Total Income from Operations | 1196.66 | 1,344.14 | 3839.67 | 3518.33 |
| 2 | Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary items) | (108.17) | 89.84 | 212.93 | 140.06 |
| 3 | Net Profit / (Loss) for the period before tax (after exceptional and/or extraordinary items) | (108.17) | 89.84 | 212.93 | 140.06 |
| 4 | Net Profit / (Loss) for the period after tax (after exceptional and/or extraordinary items) | (100.65) | 70.51 | 122.95 | 101.35 |
| 5 | Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)) | (100.65) | 70.51 | 122.95 | 101.35 |
| 6 | Equity Share Capital (Face value of Rs 10 each) | 1,250 | 1,250 | 1,250 | 1,250 |
| 7 | Other Equity | - | - | 1,289.21 | 1,143.71 |
| 8 | Earnings per equity shares (of Rs 10/- each) (for discontinued & continuing operations): | | | | |
| | Basic: | (0.73) | 0.62 | 1.16 | 0.91 |
| | Diluted: | (0.73) | 0.62 | 1.16 | 0.91 |

The above is an extract of the detailed format of Financial Results for the quarter and year ended on 31st March, 2024 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results for the quarter and year ended on 31st March, 2024 are available on the Stock Exchange website i.e. www.bseindia.com and on the website of the company i.e. www.marutiinfra.in.

For Maruti Infrastructure Limited,
 Chetan A Patel,
 Whole Time Director, (DIN : 00185194)
 Place : Ahmedabad
 Date : May 30, 2024
 802, Surmount, Opp. Reliance Mart, Iscon Cross Road, S. G. Highway, Ahmedabad-380015,
 Phone : 079-40093482, E-mail: maruti_infra@yahoo.com, Website: www.marutiinfra.in
 CIN: L45100GJ1994PLC023742

Konark Builders & Developers Limited

CIN: L51109GJ1984PLC094498
 REGD. OFFICE: 505, Abhishech Adroit Nvay Marg, Nr Mansi Circle, Vastrapur, Ahmedabad-380015.
www.konarkdevelopers.in
 E-Mail: kbd84@gmail.com/Konark Builders & Developers Limited

EXTRACT FROM THE STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31.03.2024

| Sr. no. | Particulars | Quarter ended on 31st March, 2024 | For the year ended on 31st March, 2024 | Corresponding 3 Months Ended on 31st March, 2023 | For the previous year ended on 31st March, 2023 |
|---------|--|-----------------------------------|--|--|---|
| 1 | Total Income from operations | 51.61 | 58.52 | 1,121.81 | 49.4 |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items) | 5.27 | 2.06 | -4,276.65 | -16.79 |
| 3 | Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items) | 5.27 | 2.06 | -4.23 | -16.79 |
| 4 | Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items) | 5.26 | 2.06 | -4.17 | -16.79 |
| 5 | Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)) | 5.26 | 2.06 | -4.17 | -16.79 |
| 6 | Equity Share Capital | 369.25 | 369.25 | 369.25 | 369.25 |
| 7 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of Previous Year (Earnings Per Share of Rs. 10/- each) (for continuing and discontinued operations) | 18.75 | 18.75 | 16.69 | 16.69 |
| | Basic: | 0.17 | 0.67 | -0.11 | -0.55 |
| | Diluted: | 0.17 | 0.67 | -0.11 | -0.55 |

Note: 1 The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and Other Disclosure Requirements) Regulation, 2015. The full format of the financial Results are available on the Stock Exchange website (www.bseindia.com) and on the Company website (www.konarkbuilders.in).
 2 The result of the Quarter ended on 31st March, 2024 were reviewed by the Audit Committee and approved by the Board of Director at its meeting held on 30th May 2024.

BY ORDER OF THE BOARD OF DIRECTOR
 FOR, Konark Builders & Developers Ltd
 Sd/-
 HITESH KUMAR GATURBHAI PEDHADIA
 MANAGING DIRECTOR (DIN : 09730310)

Place: Ahmedabad
 Date: 30/05/2024

ZEAL AQUA LIMITED

CIN: L05004GJ2009PLC056270
 Regd. Office : Block No. 347, Vill. Orma, Ta: Odipad, Surat, Gujarat 394540, India, Tel: +91 -2621-220047,
 Email : zealqua@gmail.com, Website : www.zealqua.com

EXTRACT OF AUDITED FINANCIAL RESULT FOR THE QUARTER AND YEAR ENDED 31st MARCH, 2024

| Sl. No. | Particulars | Amount in Lakh except EPS | | | | |
|---------|--|---|---|---|--|--|
| | | Quarter ended 31 st March 2024 | Quarter ended 31 st March 2023 | Quarter ended 31 st March 2024 | Year ended 31 st March 2024 | Year ended 31 st March 2023 |
| 1 | Total Income from Operations* | 6503.84 | 13837.94 | 6533.79 | 31760.41 | 38268.73 |
| 2 | Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items) | 479.75 | 349.12 | 126.42 | 1025.41 | 817.92 |
| 3 | Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary Items) | 479.75 | 349.12 | 126.42 | 1025.41 | 817.92 |
| 4 | Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items) | 479.75 | 349.12 | 126.42 | 827.19 | 705.35 |
| 5 | Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)) | 479.75 | 349.12 | 126.42 | 827.19 | 705.35 |
| 6 | Equity Share Capital | 1,260.660 | 1,260.660 | 1,260.660 | 1,260.660 | 1,260.660 |
| 7 | Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited / Unaudited Balance Sheet of the previous year | 660.145 | 660.145 | 660.145 | 660.145 | 660.145 |
| 8 | Earnings Per Share (Face value of Rs. 10/- each) (for continuing and discontinued operations) | | | | | |
| | 1. Basic: | 0.223 | 0.277 | 0.100 | 0.656 | 0.560 |
| | 2. Diluted: | 0.223 | 0.277 | 0.100 | 0.656 | 0.560 |

Note: 1 The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the websites of the Stock Exchange(s) at www.bseindia.com and the listed entity at www.zealqua.com.
 2 The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on 30th May, 2024.
 3 The figures for the quarter ended March 31, 2024 and March 31, 2023 are the balancing figures between audited figures in respect of the full financial year and the published year to date figures upto the end of third quarter which was subjected to Limited Review.
 4 Total income from operations includes only revenue from operations, other incomes are not considered.

For, Zeal Aqua Limited
 Sd/-
 PRADIPKUMAR RATILAL NANIK
 WHOLETIME DIRECTOR
 DIN: 01067716
 Date : 30.05.2024
 Place : Surat

